



Seat No. : \_\_\_\_\_

**XY-124****B.Sc. Sem.-IV  
April-2013****Physics (205)****Time : 3 Hours]****[Max. Marks : 70**

- સ્વીચ્છા :** (1) બધા પ્રશ્નોના ગુણા સરખા છે.  
 (2) પ્રશ્નપત્રમાં વપરાયેલ સંજ્ઞા પ્રચલિત અર્થ ધરાવે છે.  
 (3) ઉત્તરોનો ક્રમાંક પ્રશ્નપત્રમાંના પ્રશ્નોનો જે ક્રમાંક હોય તે દર્શાવો.

1. (અ) નિકોલ પ્રિઝમની રૂચના, કાર્ય અને ઉપયોગ વર્ણવો. 7

**અથવા**

- (1) ચતુર્થ તરંગ તક્તી (Quarter Wave Plate) એટલે શું ? તેની જાડાઈ માટેનું સૂત્ર  $\mu_0$  અને  $\mu_e$  ના પદમાં મેળવો. 4  
 (2) ટૂંકમાં સમજાવો : પોલરોઇડ

- (બ) નિકોલપ્રિઝમ અને ક્વાર્ટર વેવ પ્લેટની મદદથી, સમતલ ધ્રુવીભૂત, વૃત્તીય ધ્રુવીભૂત અને દીર્ଘવૃત્તીય ધ્રુવીભૂત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તે સમજાવો. પ્રકાશનું વિશ્લેષણ સમજાવો. 7

**અથવા**

ધ્વનિ શરૂ થયા પછી  $t$  સમયે ઊર્જા ઘનતામાં થતી વૃદ્ધિનું સમીકરણ  $E = \frac{4P}{AC} \left( 1 - e^{-\frac{AC}{4V} \cdot t} \right)$  તારવો.

2. (અ)  $\mu$  અવકાશ ( $\mu$ -Space) અને G-અવકાશ (G-Space) સમજાવો. 7

**અથવા**

એરોડિક અધિતત્ક (Ergodic hypothesis) લખો અને સાબિત કરો.

- (બ) કેનોનિકલ એન્સેમ્બલ સમજાવો અને ગિબ્સ કેનોનિકલ વિતરણનું સૂત્ર મેળવો તે શું દર્શાવે છે ? 7

**અથવા**

આદર્શવાયુ માટે પાર્ટીશન વિધેય મેળવો તે પરથી હેલ્પોલ્ટજ મુક્ત ઊર્જા F અને એન્ટ્રોપી Sના સૂત્રો મેળવો.

3. (अ) लोरेन्टज रूपांतरणो मेणवो. दर्शावो के ओहा वेग माटे आ सभीकरण रूप ले छे. 7

**अथवा**

वेग साथे द्रव्यमानमां थतो फेरफार समजावी जड़री सूत्रो मेणवो.

(ब) ईहरेनफ्स्टनुं प्रमेय  $\langle P \rangle = m d \frac{\langle x \rangle}{dt}$  मेणवो. 7

**अथवा**

तरंगविधेय परनी मान्य शरतो जणावो अने समजूती आपो.

4. (अ) क्वोन्टम यंत्रशास्त्रनो चोथो अधितक लभो अने गत्यात्मक चल  $A(\vec{X}, \vec{P}, t)$  माटे साबित करो के

$$\left( \frac{dA}{dt} \right)_{op} = \frac{1}{ih} [A_{op}, H_{op}] + \frac{\partial A_{op}}{\partial t}$$

**अथवा**

हाईजनबर्गनो अनिश्चिततानो सिद्धांत आपो. तेनुं गाणितीय स्वरूप आपी व्यापक सूत्र मेणवो.

(ब) (1) क्लोजरना गुणधर्म पर नोंध लभो. 3

(2) आईगन विधेय अने आईगन मूल्यनुं भौतिक अर्थधटन आपो. 4

**अथवा**

N-कणोना तंत्र माटे श्रोडिन्जर सभीकरण अने संभावना अर्थधटन मेणवो. 7

5. टूंकमां जवाब आपो : (प्रत्येक प्रश्न 1 मार्कनो छे.) 14

(1) ध्रुवीभुत प्रकाशनी व्याख्या आपो.

(2) ऋण स्फटिकनी व्याख्या आपो.

(3) धग अक्ष (Optic axis) एटले शुं ?

(4) धनि उर्जानी वृद्धि अने क्षय दर्शावतो डायाग्राम दोरो.

(5) अन्सेम्बल एटले शुं ?

(6) समान संभावनानो नियम लभो.

(7) माईक्रोनोनिकल अन्सेम्बल एटले शुं ?

(8) ग्रान्डक्रोनिकल अन्सेम्बल व्याख्यायित करो.

(9) व्याख्या आपो : जडत्वीय संदर्भ भूमिका

(10) विशिष्ट सापेक्षवादनो कोईपछा एक अधितक लभो.

(11) माईकलसन-मोर्वेना प्रयोगनुं कोई एक नकारात्मक परिणाम लभो.

(12) व्याख्या आपो : संलग्नकारक

(13) व्याख्या आपो : स्वंसंलग्नकारक

(14) क्वोन्टम यंत्रशास्त्रनी प्रथम पूर्वधारणा लभो.

Seat No. : \_\_\_\_\_

## **XY-124**

**B.Sc. Sem.-IV  
April-2013**

## **Physics (205)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

- Instructions :**
- (1) All questions carry equal marks.
  - (2) Symbol used in the question paper have usual meaning.
  - (3) The number of answer should be the same as the number of question in question paper.

1. (a) Describe the construction, working and uses of Nicol prism. 7

**OR**

- (1) What is Quarter wave plate ? Obtain an expression for thickness of it, in terms of  $\mu_0$  and  $\mu_e$ . 4

- (2) Explain in brief : Polaroid. 3

- (b) How plane polarized, circularly polarized and elliptically polarized light obtained using Nicol-prism and Quarter wave plate ? Explain analysis of light. 7

**OR**

Obtain an expression for energy density  $E = \frac{4P}{AC} \left( 1 - e^{-\frac{-AC}{4V} \cdot t} \right)$  at time  $t$ , after the start of the sound.

2. (a) Explain the  $\mu$ -space and the G-space. 7

**OR**

State Ergodic hypothesis and prove it.

- (b) Explain canonical ensembles. Obtain an expression for Gibb's canonical distribution. What it represents ? 7

**OR**

Obtain the partition function for ideal gas. From that obtain the expression for Helmholtz's Free energy F and Entropy S.

3. (a) Derive Lorentz's transformation equation. Show that for small velocity such equation takes place of Galilean transformation. 7

**OR**

Explain the variation of mass with velocity and obtain the necessary formula.

- (b) Obtain Ehrenfest's theorem  $\langle P \rangle = m d \frac{\langle x \rangle}{dt}$ . 7

**OR**

State and explain admissibility conditions on wave function.

4. (a) State the 4<sup>th</sup> postulate of Quantum Mechanics. Hence prove that for dynamical variable  $A(\vec{X}, \vec{P}, t)$   $\left( \frac{dA}{dt} \right)_{op} = \frac{1}{i\hbar} [A_{op}, H_{op}] + \frac{\partial A_{op}}{\partial t}$ . 7

**OR**

Give Heisenberg's Uncertainty principle. Give its general mathematical formula and obtain it.

- (b) (1) Write a note on 'Closure property'. 3  
(2) Give physical interpretation of eigen function and eigen value. 4

**OR**

Derive the Schrodinger's equation and probability interpretation for a system of N particles. 7

5. Each question is of 1 mark. Answer in short. 14

- (1) Define polarized light.
- (2) Define Negative Crystal.
- (3) What is an optic axis ?
- (4) Draw diagram which represents the growth and decay of sound energy.
- (5) What is an Ensemble ?
- (6) State principle of apriori probability.
- (7) What is Microcanonical Ensemble.
- (8) Define Grandcanonical Ensemble.
- (9) Define "the inertial frame of reference".
- (10) Write any one postulates of special theory of relativity.
- (11) Write any one negative results of Michelson-Morley experiment.
- (12) Define : Adjoint of an operator.
- (13) Define : A self adjoint operator.
- (14) Write the first postulate of Quantum Mechanics.